

Ref No: GARL/SEC/24-25/22

Date: 8th August, 2024

To,
BSE Limited
Department of Corporate Services,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai - 400 001
Scrip Code: 539725

To,
National Stock Exchange of India Limited
Listing Department,
Exchange Plaza, C-1,Block G,
Bandra Kurla Complex,
Bandra (E), Mumbai - 400 051
Symbol: GOKULAGRO

Sub: Newspaper Advertisement - Notice of 10<sup>th</sup> Annual General Meeting, E-Voting Information and Record Date

Dear Sir/Madam,

Pursuant to Regulation 30 and 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) 2015, kindly find enclosed herewith newspaper advertisement published in Free Press Gujarat (English) and Lokmitra (Gujarati), Ahmedabad Edition, newspapers on 8th August, 2024 with regards to Notice of 10th Annual General Meeting of the Company, E-Voting Information, Record Date and other related information.

The said newspaper clippings have also been uploaded on the website of the company at www.gokulagro.com.

Kindly take the above information on record.

Thanking You, Yours Faithfully,

For and on behalf of Gokul Agro Resources Limited

Ankita Parmar Company Secretary and Compliance Officer

Encl: As Above

Corporate & Registered Office:

Gokul Agro Resources Ltd., Crown 3, Inspire Business Park, Shantigram, Nr. Vaishnodevi Circle, S.G. Highway, Ahmedabad -382421, Gujarat-india. p.: 079 6712 3500 / 6712 3501 | m.: 90999 08537 | fax: 079 67123502 Plant(Gujarat): 76/1p, 80, 89, 91 Meghpar Borichi, Galpadar Road, Nr. Sharma Resort, Tal.: Anjar Dist. - Kutch - 370110, Gujarat-india.m.: 72269 27175

Plant(Andhra Pradesh): Survey No.:929, 929A & 929B, Vill. EPURU BIT-1 Doruvulapalem Panchayat Muthukuru, Sri Potti Sriramulu Nellore Dist.-524323 Andhra Pradesh, India. m: 72279 17006 Plant(West Bengal):

J.L No.149, P.S Bhabanipur, Mouza - Debhog, Haldia-721657 District - Purba Medinipur, West Bengal. m: 72270 37646

# THE ESSENCE OF SPIRITUAL, PHYSICAL AND MENTAL WELLNESS What Is Mental Health? According to "Uk Mental uldes: our emotional, chological, and social vell-values: our emotional, chological, and social vell-values our emotional chological and social vell-values our emotional chological and social vell-values our emotional chological vell-values our emotional chological chological vell-values our emotional chological and social vell-values our emotional

What Is Mental Health? According to "Uk Mental Health Source" Mental health includes: our emotional, includes: our emotional, psychological, and social well-being. It affects how we think, feel, and act. It also helps determine how we handle stress, relate to others, and make choices. Mental health is important at every stage of life, from childhood and adolescence through adolescence through

adolescence through adulthood. A state of mental wellbeing of a person with an ability to cope with stress or not. Undoubtedly, Over the course of your life

Over the course of your life journey if you experience mental health problems it will be established that your thinking, mood, and behavior could be affected. Many factors contribute to mental health problems, including: Biological factors, such as genes or brain chemistry, Life experiences, such as trauma or abuse, Family history of mental health problems.

such as trauma or abuse, Family history of mental health problems
Early Warning Signs
Eating or sleeping too much or too little (Bullimia nervosa, SRED), pulling away from people and usual activities, Having low or no energy, Feeling numb or like nothing matters, having unexplained aches and pains, Feeling helpless or hopeless, Smoking, drinking, or using drugs more than usual, Feeling unusually confused, forgetful, on edge, angry, upset, worried, or scared, Yelling or fighting with family and friends, Experiencing severe mood swings that cause problems in relationships, Having persistent thoughts and memories you can't get out of your head. Hearing voices or

memories you can't get out of your head, Hearing voices or believing things that are not true, Thinking of harming yourself or others, Inability to perform daily tasks like taking care of your kids or getting to work or school

care of your kids or getting to work or school
Mental wellness simply means in my own definition taking the necessary steps to ensure you're living healthy and these steps can be spiritually, medically and physically or ability to achieve an optimal functional state of the body system of a person.
But let's understand that man is TRIPARTITE BEING he is made of 3 important PARTS

is made of 3 important PARTS which includes: spirit, soul and body and of utmost importance all these various compartments need care without an exception from another. Perhaps, for us to achieve mental wellness there

stability of our system.
Depression and mental illness are real, it might be medical or spiritually inclined but the fundamental truth remains that everything about spiritual mental illness has its genesis and exodus from our mind; "our mind is a fertile ground where seeds both (good or bad) are sown, it's the seat of power of man, it's the seat of power of man, it's the trigger point of actions and inactions" our inability to befriend our mind will always befriend our mind will always result in mind diarrhea (influx or invading of uncontrollable thoughts), a prodigal mind can't experience a healthy mental wellness.

ental wellness. Friends, I want from the scriptural point of view to establish a few factors that cause spiritual and mental decline against our mental

decline against our mental wellness.
WHEN VISION AND ASPIRATIONS LACKS SUPPORT:
Eccl.9.15 - Now there lived in that city a man poor but wise, and he saved the city by his wisdom. But nobody remembered that poor man.
TALENTED but your voice isn't heard, BIRTHED with great visions but no support; all these causes mental lireakdown and disorder physically, spiritually and mentally.

breakdown and disorder physically, spiritually and mentally.

D E F E R R E D EXPECIATIONS:

Prov.13.12 - Hope deferred makes the heart sick, but a longing fulfilled is a tree of life. Always prepare for success and failure in any adventure. This is one of the secrets of great men, this helps them to deal with depression, 50/50 rule is important. However, when a business deal closes succees fully, career plans succeed, kids are doing well, etc. it imparts positively on our mental wellness or wellbeing but when it's on a negative, it breeds depression. Understand only our CREATOR is perfect and that can be proven by HIS Creation, MAN will always be prone to errors and mistakes so always balance your expectations in all your endeavors.

balance your expectations in all your endeavors. LACK OF JOY: Prov.17.22 - A cheerful heart is good medicine, but a crushed spirit dries up the bones.

JOY deflates pressure and

of anxiety or stress, and improve a low mood by borotten dopamine and endorphinevels. According to a small 2017 cheeding a small 2017 cheeding and strong both the love hormone," oxytocin is cessential for chilabirth, breastfeeding, and strong both the love hormone, and the love hormone

with someone you love, and bonding over meal preparation, can boost oxytocin levels. Certain foods



study; Trusted Source showed that looking at 12 young men, social laughter triggered

social laughter triggered endorphin release.
So, share that funny video, dust off your joke book, or watch a comedy special with a friend or partner.
Bonding over something hilarious with a loved one might even trigger oxytocin release.

might even trigger oxytocin release. HAPPY HORMONES OR MOOD BOOSTERS Hormones are chemicals produced by different glands across your body. They travel through the bloodstream, acting as messengers and playing a part in many bodily processes. One of these important functions? Certain hormones are known to help promote positive feelings, including happiness and pleasure; these "happy hormones" include:

? Dopamine: Known as the "feel-good" hormone, dopamine in acurotransmitter that's an

neurotransmitter that's an important part of your brain's reward system. It's associated with pleasurable sensations, along with learning, memory, and more.

? Serotonin: This hormone and neurotransmitter helps

Bangrecha had mistakenly entered another person's bowling lane. A man named Mihir Singh then abused Bangrecha and Yashdeep. When the boys protested, Singh allegedly slapped them and punched

them in their faces. A woman, identified as Kavya Mishra, also allegedly slapped Yashdeep and

Bangrecha.
Yashdeep told his father
that two other men, Rahil

that two other men, Rahil and Poojan, pushed them to the floor and hit them with a bowling ball. The four also threatened to kill Yashdeep and Bangrecha. Bangrecha and Yashdeep called their family members and then called the police control room. Vastrapur police registered a case of causing hurt, criminal intimidation, using abusive words and abetment against the four persons accused and began an investigation.

investigation.

Police have gathered
CCTV footage of the
incident to know what had
happened.

parent-child bonding. It can also help promote trust, empathy, and bonding in relationships. Levels generally increase with physical affection.

? Endorphins: These hormones are your body's natural pain reliever, which your body produces in response to stress or discomfort. Levels may also increase when you engage in reward-producing activities such as eating, working out, or having sex.

WAY TO PRODUCE MORE
OF THE NATURAL MOOD BOOSTERS.
? Looking to boost your serotonin level? Spending time outdoors, in sunlight, is a great way to do this. According to research, exposure to ultraviolet (UV) radiation from the sun can increase the production of serotonin. ? But exercise doesn't just work on endorphins. Regular physical activity can also increase your dopamine and serotonin an endorphins. Regular physical activity can also increase your dopamine and serotonin levels, making it a great option to boost your happy hormones ? Cooking and enjoying a favorite meal with a loved one: The enjoyment you get from

can also have an impact on hormone levels, so note the following when meal planning for a happy hormone boost: spicy foods may trigger endorphin release yogurt, beans, eggs, meats with low-fat content, and almonds are just a few foods linked to donamine release fords birth

fat content, and almonds are just a few foods linked to dopamine release foods high in typtophan have been linked to increased serotonin levels, foods containing probiotics, such as yogurt, kimchi, and sauerkraut, can influence the release of hormones.

\*\*PListen to music (or make some): Music can give more than one of your happy hormones a boost. Listening to instrumental music, especially music that gives you chills, can increase dopamine production in your brain. You may also experience an endorphin release while performing music, especially music, especially music that gives in a large group. For example, a 2016 study Trusted Source found that choir members experienced increased endorphin release during rehearsals. ? Meditate: If you're familiar with meditation, you might already know of its many wellness benefits from improving sleep to reducing stress.

attracted to someone can lead to the production of oxytocin. But physical affection, including kissing, cuddling, or having sex, also contributes to oxytocin production. Just spending time with someone you care about can also help bacet oxytocin production.

you care about can also neip boost oxytocin production. This can help increase closeness and positive relationship feelings, making you feel happy, blissful, or even euphoric. If you really want to feel those happy hormones, note that dancing and sex both lead to endorphin release note that dancing and sex both lead to endorphin release, while orgasm triggers dopamine release, you can also share a glass of wine with your partner for an added endorphin boost.

endorphin boost.
? Pet your dog: If you have a dog, giving your furry friend some affection is a great way to boost oxytocin levels for you and your dog. According to research "Trusted Source", dog owners as well as their dogs see an increase in oxytocin when interacting. Even if you don't own a dog, you might also experience an oxytocin boost when you see a dog you know and like. If you're a dog lover, this might happen when you get a chance to pet any dog at all.
? Get a good night's sleep; Not getting enough quality sleep can affect your health in multiple ways. For one, it can contribute to an imbalance of hormones, particularly dopamine, in your body. This can have a negative impact on your mood as well as your physical health, setting aside 7 to 9 hours each night for sleep can help restore the balance of hormones in your body, which will likely help you feel better. If you find it difficult to get a good night's sleep, try: going to bed and getting up around the same time every day, creating a quiet, restful sleeping environment (try reducing light, noise, and screens) decreasing caffeine intake, especially in the afternoon and evening? Manage stress: It's normal to experience some stress from time to time. But living with regular stress of

life events can cause drops in

dopamine and serotonin

physical activity, meditation, sapal interaction, any of these approaches may help relieve your stress while also boosting your levels of serotonin, dopamine, and even endorphins.

7 Get a massage: If you enjoy a massage, here's one more reason to get one: massage can boost all four of your happy hormones. According to studies, massage boosts endorphins. Older research found that massage also increases serotonin and also increases serotonin and also increases serotonin and dopamine. You can get these benefits from a massage by a licensed massage therapist, but you can also get a massage from a partner for some extra oxytocin.

minds. Which implies spiritual mental illness starts with LIES from the devil so always scriptures as Jesus did during

scriptures as Jesus did during his wilderness experience.

U N H E A L T H Y COMPETTION:
Peer group pressure, social media pressure (behind social media are many unseen battles, shaft waters, untold stories, lies and deceit, family pressure) it's paramount to understand there's no competition in destiny, life happens to everyone at his own time and season, billions of stars in our galaxy system of stars in our galaxy system

of stars in our galaxy system all shine independently with no pressure and competition from another. Having established the above facts about mental health let's see the essence of mental health, spiritually and obsciza

kut you can also get a massage from a partner for some extra oxytocin. FEAR OF THE UNKNOWN PUTURE:

which stems from our inability to find our purpose of existence and living; perhaps this can cause anxiety disorder, depression and inferiority complex and low self-esteem but the scriptures gives hope which helps us to curb fear of the unknown - Jer 29:11, Jere 1:5, Prob 25:2

UNDERSTAND YOU'RE NOT DEFINED BY YOUR DIHEATTH THOUGHTS:
NOT DEFINED BY YOUR UNHEATTH THOUGHTS:
John. 8:44 - You belong to your father, the devil, and you want to carry out your father's desire. He was a murderer from the beginning, not nolding to the truth, for the reis no truth in him. When he lies, he speaks his native language, for he is a liar and the father of lies.

The basic principle of spirtual waffare against man is LIES from the devil which



#### **GOKUL AGRO RESOURCES LIMITED**

Notice is hereby given that the Tenth (10th) Annual General Meeting ("AGM") the members of Gokul Agro Resources Limited ("the Company") will be held of Harusday, 29th August, 2024 at 11:30 a.M. (IST) Through Video Conferenc ("VC") Ulther Audio Visual Means ("QAVM") to transact the businesses, as se out in the notice convening AGM.

2024 to Thursday, 29th August, 2024 (both days inclusive) for the purpose of 10th AGM of the Company.

Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended and Regulations 40 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the shareholders are provided with the facility to cast their votes on all resolutions as set forth in the Notec convening the AGM using electronic voting system (Themate evoling) provided by COSL. The voting right of Shareholders shall be in proportion to the equity shares hald by them in right of Shareholders shall be in proportion to the equity shares hald by them in viting the continuity of the shareholders are capital of the Company as on Trillay, 18th August, 1204 at 91.

Additionally, the Company is providing remote e-voting facility ("remote e-voting) to all its members to cast their votes on all resolutions as set out in the Notice of AGM. The remote e-voting period will commence on Thursday, 22nd August, 2204 at 50.0 a.m. (IST) and will end on Wednedskay, 28th August, 2204 at 50.0 a.m. (IST) and side shall be disabled by COSL the earth.

Those Shareholders, who shall be present in the AGM through V.CDAMM facility and flant or the start votes on the Resolutions through remote e-voting and and had not set that rive votes on the Resolutions through remote e-voting and early of the AGM through V.CDAMM facility and flant on the start votes on the Resolutions through remote e-voting and early and the AGM and the control of the revolution shrough remote e-voting and early and the control of the control of

evotingindia.com. ers may kindly note that in terms of aforementioned Circulars, th ny will not be sending physical copies of AGM notice and Annual Repo

CDSL
Address: 25th Floor, A Wing, Marathon Futurex,
NM Joshi Marg, Lower Parel (E), Mumbai - 400 01
Tel No. 022-23058542/43 or
E-mail ID: helpdesk.evoting@cdslindia.com

## 4 attack 2 teenagers at bowling alley in Ahmedabad beating Yashdeep and Bangrecha. Dinesh informed Bangrecha's parents and they rushed to the mall. When they got there, Yashdeep told his father that he and Bangrecha had mistakenly entered another person's



and a woman allegedly attacked two 16-year-old boys, after a dispute at a wling alley in a Vastrapur

mall on Tuesday evening.

Dinesh Garg, a chartered accountant and resident of Shahibaug, in his FIR said that

his son, Yashdeep, and his friend, Dhyey Bangrecha, were attacked by four persons at a bowling alley on the thi floor of Himalaya Mall

Vastrapur.

Dinesh said his son-in-law
on Tuesday night told him that
some unknown people were

Rajkot and Ahmedabad railway staff

among top three in recovering penalty
AHMEDABAD: The ticket checking staff from Rajkot division
collected over Rs 1 crore as penalty from travellers traveling
without proper tickets and carrying luggage without booking.
Railway officials said that the checking staff from Rajkot Division
KD Oza who is deputy chief ticketing inspector (Dy CTI) from
Rajkot Division. Apart from Oza, Zahid Qureshi – DY CTI with
the flying squad at Churchgate had also achieved the collecting
of over Rs 1 Crore each as penalties.

Oza has collected Rs 1.13 crore from 14,928 cases in the
current FY 2022-23 till February 2023, while Zahid Qureshi
collected Rs 1.06 crore with the detection of 13,116 cases
from January to December 2022.

collected Rs 1.0b crore with the detection of 15,11b cases from January to December 2022.

Ajmer Singh, senior ticket examiner from Ahmedabad Division has also has collected Rs 93.47 lakh from 17,806 cases. Officials stated that Western Railway's women ticket-checking staff are not far behind their male counterparts in this field.

Shail Tiwari, Dy CTI from Ahmedabad Division, collected

Mokarsagar wetland to be developed as eco-

RAJKOT: The Mokarsagar wetland in Porbandar district which is home to several migratory birds will be developed as eco-tourism site at the cost of Rs 200 crore. The announcement was made by the Gujarat minister for water sunolv and water for water sunolv and water

The announcement was made by the Gujarat minister for water supply and water resource Kunvari Bavallya on Wednesday on the occasion of World Water Day in Porbandar. According to Bavallya, the co-tourism project will help reduce degradation because of seawater. Talking to the media persons, Bavaliya said, "The state government is working on the projects to make the land fertile. At the same time, we are also developing important wetlands like Mokarsagar as an ecotourism site." The Mokarsagar wetland in Porbandar is home to over 90 bird species. Several migratory birds visit the wetland every year. Bavaliya said that the water resource and water supply department will develop an interpretation centre, watch tower, approach roads and other necessary infrastructure there. The eco-tourism site will become an addea dattraction for tourists travelling on Saurashtra's tourism circuit. attraction for tourists travelling on Saurashtra's tourism circuit — Somnath, Madhupur, Porbandar and Dwarka, said the minister adding that it will also generate employment for the locals. According to the official data, this year 5.70 lakh

The Food and Drug Administration (FDA) is responsible for the safety and effectiveness of drugs sold in the United States. The process to get the FDA's approval for a pharmaceutical product is usually very long and complicated.

The FDAS Center for Drug Evaluation and Research (CDER) conducts research to test the drug's quality, but the pharmaceutical companies that aim at introducing a new product on the US market are responsible for extensive testing of the drugs to prove they're safe and effective. The CDER then reviews the data included in the new drug application (NDA). After the development phase, the FDA goes though preclinical and clinical research, review, and post-market safety monitoring. Experts in this field rarely share their advice on how to deal with the FDA in the most effective way and how to be successful in the pharmaceutical business. "Mastering the art of communication and being proficient in marketing techniques can be helpful," told us Alessandro Ricci, president of the US branch of the Chinese big pharma company Aurisco. "You have to discover a product's potential, develop a plan, and clearly describe the assets

and advantages a drug can bring to the American market and the world in general," explained the Italian CEO, product developer and expert of the life-cycle management associated with the supply chain. Having a nice dose of charm, being personable, and able to put people at ease are other important qualities to

velop. Mr. Ricci is responsible for Mr. Ricci is responsible for the success of very popular drugs and active substances, such as the extremely popular steroid medicine Fluticasone Propionate, generic of Advair. Sold today under the brand names Flovent and Flonase among others this product works by under the brand names Flovent and Flonase among others, this product works by decreasing inflammation and is used for the long-term management of astma, but also to treat hay fever, nasal polyps, and mouth ulcers. With over 24 million prescriptions, Fluticasone was the 23rd most prescribed medication in the United States in 2020. "I make the technical aspects very simple for clients and supervise the document filing for drugs to be successful with the FDAS approval; Full with 43-year-old entrepreneur added. Mr. Ricci is also the mind behind the development of the Active Pharmaceutical Ingredient (API) Fulvestrant.

## production. This can negatively affect your health and mood, making it harder to deal with stress. If you're under a lot of stress, the American Psychological Keys for success in the **Big Pharma field**

# વિશ્વની અરધી જનસંખ્યા પર કાતિલ જળસંકટ

ગત ગ્રીષ્મની રજાઓમાં જેઓ કુલુ-મનાલી ગયા તેમને સ્થાનિક સત્તાવાળાઓએ માત્ર . .. પાણીની તંગીને કારણે સાભાર પરત મોકલી આપ્યા. ઇતિહાસમાં પહેલીવાર સિમલામાં પાણીની એવી કટોકટી સર્જાઈ કે લોકોએ ટેક્રરો સામે લાંબી લાઈનમાં ઊભા રહેવું પડયું. સિમલામાં સ્થાનિક જનસંખ્યા પરી બે લાખ પણ નથી, પરંતુ આ વરસે ચાર-પાંચ લાખ નાગરિકો પ્રવાસે આવ્યા. એ વખતે શિયાળામાં હિમવર્ષા પણ નહીં જેવી થઈ હતી ઉત્તર ભારતની મોસમ બદલે એટલે દરેક ઋતુ તેનો નિયત ક્રમ બદલાવે તે લાંબા અરસામાં સમગ્ર દેશ માટે ચિંતાજનક સંકેત છે. ગયા ગારા ચોમાગાને કારણે અત્યારે શિયાળામાં તો નદીઓ પરપાટ બે કાંઠે વહેવા લાગી છે. નર્મદાના વહેણ ધસમસતા ઘઘવાટ કરતા આગળ વધી રહ્યાં છે. સંત કબીર કહે છે કે દુ:ખ મેં સુમિરન (પ્રભુસ્મરણ) સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કા હોય? વરસાદને જોઈને આપણે ઘેલા થઈ જઈએ છીએ. જળસંકટ વિસરાઈ જાય છે. સિમલાની પ્રજાએ પીવાના પાણીની જે કારમી તંગી અનુભવી તે આમ તો દેશના અનેક પ્રદેશો દાયકાઓથી સહન કરતા આવ્યા છે, પરંતુ સિમલાએ દેશભરના પ્રવાસીઓનું ુ -તા પછા જનસમુદાયનું જળસંકટ તરફ ધ્યાન દોર્યું. જોકે ભારતીય પ્રજાની ગણના છ કે હાથે પાણીનો વેડકાટ-વ્યય કરવામાં થાય છે. હિમાચલ પ્રદેશના ભાજપના તત્કાલીન મુખ્યમંત્રી જયરામ ઠાકરે સિમલાથી કલ-મનાલી સુધીના સમગ્ર વિસ્તારમાં પાણીનો પુરવઠો જાળવવા અથાક પ્રયત્નો કર્યા, પરંતુ કારગત ન નવીડયા. છેવટે હિમાચલ પ્રદેશમાંથી પ્રવાસીઓ ખાલસા થઈ ગયા. જમ્મ અને કાશ્મીરના હિંસાચાર અને અરાજકતાને કારણે ટુરિઝમની મોટી આવક ઢાળતા ઢાળે હિમાચલ પ્રદેશને પ્રાપ્ત થતી હતી. મખ્યમંત્રી સુખવિન્દરે રૂપિયા એક હજાર કરોડ રાતોરાત જળસંકટ નિવારવા માટે ફાળવ્યા છે. અગાઉ લાખો પ્રવાસીઓએ હિમાચલ પ્રદેશ છોડવું પડ્યું હતું અને અપપ્રચારને કારણે ુ ...ુ ાસનને ગંભીર નુકસાન થયું હતું. બધી જ ફાઇવસ્ટાર હોટેલ સૂમસામ પ્રવાસીઓનો ધસારો નથી એવા બુંદેલખંડ જેવા અનેક પ્રદેશો દેશમાં આજે પણ એવા છે જેને માટે સરકારે કરોડો રૂપિયાના ફંડ ફાળવવાના બાકી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગજરાત સાથે હવે હિમાચલ પ્રદેશ ુ મુણ પીવાના પાણીની કટોકટી ભોગવવા લાગતા ઉત્તર અને મધ્ય ભારતના બદલાયેલા હવામાનને નવો સંકટકાળ જાહેર થવા લાગ્યો છે. પાણીની સમસ્યાને માત્ર વરસાદ સાથે જોડીને અન્ય અનેક પાસાઓની ઊપેક્ષા થઈ રહી છે. વાસ્તવમાં દેશમાં ભૂગર્ભજળનું સ્તર ઝડપથી ઊંડે જવા લાગ્યં છે. કારણ કે કલ વરસાદી જળ, તેમાંથી થતો સંગ્રહ અને એના વ્યવસ્થાપનની તુલનામાં કુલ વપરાશી જળનું પ્રમાણ બહુ મોટું છે. એની સામે આ વીતેલા ઉનાળામાં તો નર્મદા સહિતના દેશના સંખ્યાબંધ જળાશયોનાં તળિયાં દેખાવા લાગ્યાં હતાં. વપરાશી જળની માત્રા અધિક હોવાને કારણે ભૂગર્ભજળનું દોહન વધી ગયું છે. રાજસ્થાન, હરિયાણા, મીટરથી વધ ઊંડે સરી ગયું છે. મધ્ય. દક્ષિણ ગુજરાતમાં પાણીનું સ્તર હર્જુ ઉપર છે. તે પણ આવનારા નજીકના વરસોમાં ઊંડે જશે. બુંદેલખંડમાં સતત દુષ્કાળની પરંપરા છે. ઉત્તર



સંસાધનોની સાર્વત્રિક ઘટ વર્તાવા લાગી છે. પીવાના તરોતાજ પાણીની અછત એમાં ટોચના ક્રમે છે દુનિયાનાં તમામ મહાનગરોમાં -પ્રદેષણને કારણે અને અછતથી પીવાના પાણીની તંગી વર્તાઈ રહી છે. શહેરો ગીચ થતા જાય છે રોજગારી અને ઔદ્યોગિક મંદીને કારણે શહેરો હવે વિરાટ ગામડાંઓ બની ગયા છે. કારણ કે સરકાર જેટલી સગવડ વધારીને શહેરનું નવીનીકરણ કરે છે એનાથી ત્રિગુણિત ઝડપે શહેરી વસ્તી અભિવૃદ્ધ થતી રહે છે. ગ્લોબલ વોર્મિંગ સહિતનાં કારણોથી મોસમ બદલાતી રહે છે. વરસાદ હવે આગાહીઓને અનુસરતો નથી, કારણ કે વીજળીક ગતિએ મોસમમાં પલટા આવવા લાગે છે. વૃક્ષનો પ્રચાર છે, પરંતુ પ્રજામાં વૃક્ષનો વિચાર નથી. હજુ જંગલો કપાતા રહે છે, પૃથ્વી પરથી હરિયાળી ચાદર સંકેલાતી જ જાય છે. પાણી માટેનાં નવાં સંસાધનો ઊભાં કરવા માટેન પ્રોજેક્ટમાં જ કરોડો રૂપિયા સરકારે વહાવી દેવા પડે એવા સંયોગો રચાવ લાગ્યા છે. અખાતી દેશો પાણીની જે તંગીનો અનુભવ કરી રહ્યા છે એ વોટર સ્ટ્રેસ છે, કારણ કે જરૂરિયાતના પ્રમાણમાં પીવાના પાણીની ઉપલબ્ધિ નહિવત્ છે. એ જ પરિસ્થિતિ ભારતનાં અને કરાજ્યોમાં હવે સર્જાવા લાગી છે. શહેરોની સાથે જે છે. જંગલોની વચ્ચે થઇને વહેતી નદીઓ હવે પહેલાં જેવી નથી. એના રેતાળ પટ પણ વેરાન થઇ ગયા છે એક પણ નદીમાં ખનિજ ચોર ટોળકીએ રેતી રહેવા દીધી નથી તેઓને રાજકારણીઓનું ગુપ્ત સમર્થન હોય છે અને તેઓ ટ્રકબંધ અને ટનબંધ રેતી ઉપાડે છે. એશિયન દેશોનું પર્યાવરણ નિમ્ન કક્ષાએ પહોંચતા હવે પીવાના પાણીના વ્યવસ્થાતંત્ર માટે ભવિષ્યની . સરકારોએ વોટરટેક્સ દાખલ

અત્યારના નળવેરા કે પાણીવેરા કરતા અલગ અને ઊંચા દર ઘરાવતા હશે. થોડા સમય પહેલા મહારાષ્ટમાં ઔરંગાબાદમાં માત્ર નળ-કનેકશનના વિવાદમાં સાંપ્રદાયિક તોફાનોની આગ ભડકી ઉઠી જેમાં થોડી જાનહાનિ ઉપરાંત સંખ્યાબંધ દુકાનોને સળગાવી દેવાઈ. હજુ ત્યાં ભારેલો અગ્નિ છે. સમસ્યાનું મૂળ માત્ર પીવાનું પાણી છે. પાણી માટે પાણીપત થતાં વાર લાગતી નથી. મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠાવાડા વિસ્તારમાં તો ભૂગર્ભજળનો પત્તો જ નથી લાગતો. સ્થિતિ ભયાવહ થવા લાગી છે. શેરબજારોથી કષિભંડારો સધી માત્ર પાણીના અભાવે દેશમાં સશાટો મચી જવાની સ્થિતિ છે. કેન્દ્રીય જળ સંસાધન મંત્રાલયની ઉતાવળી ધારણા પ્રમાણે ભારતમાં ઇ.સ. ૨૦૫૦ સુધીમાં પાણીની જરૂરિયાતમાં ૫૦ ટકા વધારો થશે. પ્રમાણે આ વધારો ૩૦૦ ટકાનેય પાર કરી જશે. એટલે સ્થિતિ વિકટ બનશે એક અંદાજ પ્રમાણે વિશ્વમાં પેટ્રોલિયમના ભંડારો ખાલી થશે એના દાયકાઓ અગાઉ ભૂગર્ભ જળભંડારો ખાલસા થઇ જશે. માત્ર પોતાનો અને એ પણ ઘડીક પૂરતો જ વિચાર કરનારી એશિયન પ્રજા જળના ભવિષ્યના આયોજન માટે અનિશ્ચિતતા, અસ્પષ્ટતા અને આસમાની મનોવૃત્તિ સિવાય બીજું

**६२वाना दिवसो आवशे** श्रे

કંઇ નથી. જે છે તે એટલું અપૂરતું છે કે જરુરિયાત સામે એની કોઈ વિસાત નથી. પાણીને યુનેસ્કોએ માનવાધિકારનો દરજ્જો આપી દીધો છે. આજે દુનિયામાં ૧૦૦ કરોડ લોકો એવી જિંદગી વીતાવે છે કે તેમની પાસે પીવાનું શુદ્ધ જળ ઉપલબ્ધ નથી. યનેસ્કોના જાહેરનામા પ્રમાણે ઇ.સ. ુ ૨૦૨૫ સુધીમાં જ વિશ્વની અરધી જનસંખ્યા પીવાના પાણીના ઘેરા સંકટમાં અટવાઈ જશે. કોઈ મહામારી માણસજાત માટે વિનાશ નોંતરે એ પહેલા પાણીનો અભાવ જ એના શ્વાસ ટૂંકાવશે અને એવી સંખ્યા પણ કરોડોમાં હશે. જે સંકટ દનિયા પર તોળાઈ રહ્યું છે તે મુખ્યત્વે અવિકસિત કે વિકાસશીલ દેશોના નાગરિકોને જ હણશે. અને ભારત એમાંથી બાકાત નહીં હોય. ભારતીય પ્રજાપાસે પ્રાચીન વનસંસ્કૃતિ અને પ્રાકૃતિક ગ્વન પદ્ધતિનો વિરાટ વારસો છે જે હવે નષ્ટપ્રાય: થવા આવ્યો છે યુનેસ્કોએ કહ્યું એનો બીજો અર્થ એ પણ છે કે અસંખ્ય મહામુલી જીવસૃષ્ટિ અને વનસ્પતિઓ પણ હવે વિનાશના આરે પહોંચશે. અસ્તિત્વના નવા સંઘર્ષનો મોરચો હવે જળતત્ત્વનો છે અને એ સૌથી આકરો નીવડશે. જૂની ગુજરાતી કહેવત પ્રમાણે સહનું થાશે એ જ વહુનું થાશે એવા ઉપેક્ષાભાવથી નિશ્ચિત થઇ, બેફિકર રહી પ્રકૃતિનો મનષ્ય હવે એક એવા ત્રિભેટે આવી પહોંચ્યો છે જ્યાં પ્રથમ તો એણે આત્મદર્શન કરવાની જ જરૂર પડશે.

## મહાપુરુષનું સાનિધ્ય કોને ફળી શકે અને કોને ના ફળે? શરૂ થઈ ગઈ છે. ખાંડની નવી મોસમ

મૂલ્ય હોય છે. ઘડીભરનું સાનિધ્ય છતાં શબરીજી તરી ગયા અને વિરોધાભાવથી ભરેલું હૃદય હોવાથી-છતાંય મંથરા ચૂકી ગઈ. દર્શન . શ્રીરામનાં રાવણ તથા વિભિષણ બર્ફ ને થયા હતાં છતાં પણ વિભિષણનું જીવન ઉત્કર્ષ મય બની ગયું અને રાવણનું ડૂબી ગયું. હિરણ્યકશુને અને પ્રહલાદ બન્ને ને હરિનાં દર્શન થયા જેમાં પ્રહલાદ તરી ગયા અને હિરણ્યકશ નો વધ થયો. સમદ્રમંથન સમયે દેવો અને દાનવો બન્નેની વચ્ચે હરિ-લક્ષ્મીરૂપે પ્રગટ થયા એકને તારવા અને એક ને મારવા. મહાપુરૂષનું ગમે તે સ્વરૂપનું સાનિધ્ય ફળતું નથી મહાપુરૂષનું ભક્તિ રતને શ્રધ્ધા ભર્યા ભાવ યુક્ત સાનિધ્ય ૧ ફળે છે. જીવનને તારે છે. આંબાની નીચે બેસીએ તો કેરી અને બાવળની નીચે બેસીએ તો કાંટો મળે છે. મહાપુરૂષનાં સાનિધ્યની અસરો મન ુ. ઉપર થાય છે. જેને અપનાવવાથી જીવનની નૌકા તરી જાય છે. અને ન અપનાવવાથી તે ડૂબી જાય છે. જીવનભરનું શ્રીરામનું સાનિધ્ય મંથરાને મળ્યું, મંથરા કૈકેયીની દાસી હતી અને કૈકેયીના મહારાજ દશરથ નોતરનારી બની. ાાથે લગ્ન થયા ત્યારે મંથરા પણ કૈકેયીની સાથે જ આવી હતી. ભગવાન શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે મંથરા રાજમહેલમાં જ હતી. અને ભગવાન રામ તો કૌશલ્યના મહેલ કરતાં પણ કૈકેયીના મહેલમાં વધુ રહેતા. મંથરા તો કૈકેયીની દાસી સાનિધ્ય રામનાં જન્મથી જ મળ્યં છે. મંથરાએ બાળ રામને નવડાવ્યા હશે

તેમને જમાડયા હશે. અને કવાર

રમાડયા પણ હશે જે. ભગવાન

રામનાં પ્રાગટયથી ભગવાન રામ ચૌદ વર્ષ માટે વનમાં ગયા ત્યાં સુધી

મંથરાને રામનું નિત્ય સાનિધ્ય મળતું

યો ગી

મુખ્યમંત્રી

આદિત્યનાથે પાણી માટે ત્રણ



′રહ્યું છે. ભગવાન રામ ચૌદ વરસનો વનવાસ પૂરો કરીને અયોધ્યા આવ્યા અને અયોધ્યાના રાજા બન્યા પછી પણ મંથરા તો રાજમહેલમાં જ હતી. તેને રાજમહેલમાંથી કોઈએ કાઢી મૂકી ન હતી. આમ જોઈએ તો તે રાજમહેલની સેવિકા તરીકે શ્રીરામ અને ભગવત પરિવારની અને ક સ્વરૂપે સેવા પણ કરતી હશે જ. આટલું દીર્ઘ અને ઘનિષ્ઠ ભગવત સાંનિધ્ય છતાં મંથરા મૂઢમતિ જ રહી ! આટલા સાંનિધ્ય પછી પણ મંથરા રામના વનવાસનું કારણ બની અને રાજ પરિવાર પર મોટી આફત

સાંનિધ્ય મળ્યું તોય મંથરા આવી કેમ રહી ? મંથરા ભગવાન શ્રી રામને ચૂકી ગઈ કેમ ? કારણ કે મંથરાન ર્દૃદય શ્રી રામ પ્રત્યે વિરોધ ભાવથી ભરેલું છે. શ્રી રામને વનમાં મોકલવા માટે મંથરા એજ કૈકેયીને તૈયાર કર્યા હતા. આમ મંથરાનું સાનિધ્ય શ્રી રામ પ્રત્યે વિરોધભાવથી પરિપૂર્ણ હતું. આ થી જ તેની ગતિમાં પણ કરે છે. હવે સાંનિધ્યની બીજ ઘટનામાં શબરીજીને ભગવાન શ્રીરામનું માત્ર બે ઘડીનું સાંનિધ્ય મળ્યું પણ કેવું સાંનિધ્ય કે તે તરી ગઈ. શબરી તો કિરાત જાતિની

માતંગઋષિ શબરી પર પ્રસન્ન થયા. શબરી કિરાત સ્ત્રી હોવા છતા સરળ ,નમ્ર અને ભક્તિપૂર્ણ હૃદય થકી , મહર્ષિ માતંગ ઋષિના શિષ્યત્વને પામ્યા હતા. ગુરૂદેવનો અંતકાળ

દેશમાં ખાંડ બજાારો તથા ઉદ્યોગ ક્ષેત્રે તાજેતરમાં સમીકરણો ઝડપથી પલ્ટાતા જોવા મળ્યા છે. કોરોના કાળના પાછલા બે વર્ષ પછી આ વર્ષે લોકડાઉનના બદલે ઝડપથી રિઓ પનિંગની પ્રક્રિયા આગળ વધતાં આ વર્ષે આવેલા વિવિધ તહેવારો જનતાએ ખુબ ઉમંગ અને ઉજવ્યા છે. ઉલ્લાસપૂર્વક તાજેતરમાં દશેરા-દિવાળીના તહેવારોમાં પણ આવો અનેરો માહોલ બે વર્ષ પછી જોવા મળ્યો હતો અનેહવે ખાંડ બજારની નજર નવા વર્ષ પર મંડાઈ છે. દશેરા-દિવાળીમાં ખાંડની માગ આ વર્ષે પ્રોત્સાહક રહી હતી એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. માંગ પણ બલ્ક વપરાશકારો તરફથી સારી રહી હતી. તહેવારોમાં આ વર્ષે વિશેષ રૂપે બલ્ક વપરાશકારોની ખરીદી ખાસ્સી જોવા મળી હતી. नातालमां तो भभग विश्वमां फांउनी માગ વધતી હોય છે. દરમિયાન, देशमां आंउनी नवी मोञ्रम ૨૦૨૨-૨૩ની મોસમ ઓકટોબરથી

દેશમાં ખાંડની શરૂ થયેલી નવી મોસમને નવેમ્બર અંતે બે મહિના પૂરા થયા છે. આ બે મહિનાના ્ર હાળામાં દેશમાં ખાંડના ઉત્પાદનમાં નજીવી આશરે દોઢ ટકાની વદ્ધી યઈ હોવાનું ધી ઈન્ડિયન સુગર મિલ્સ એસોસીયેશનના સત્રોએ જણાવ્યું હતું. ઈથેનોલના ઉત્પાદન તરફ વાળવામાં આવેલ જથ્થાને બાદ કરતાં આ નવી મોસમના પ્રથમ બે ુ.... મહિનામાં દેશમાં ખાંડનું ઉત્પાદન આશરે ૪૭ લાખ૯૦ હજારટન જેટલું થયું છે જે ૨૦૨૧-૨૨ની પાછલી મોસમના આ ગાળામાં આશરે ૪૭.૨૦લાખટન જેટલું થયું હતું. આ વર્ષે બે મહિનામાં દેશમાં મિલોમાં શેરડીનું પિલાણ શરૂ થયું છે જે પાછલી મોસમમાં આ ગાળામાં આશરે ૪૧૫થી ૪૨૦ ખાંડ મિલોમાં શરૂ થયું હતું. આમ આ વર્ષે નવી મોસમના પ્રથમ બે મહિનામાં દેશમાં વધુ ખાંડ મિલો એક્ટીવ થયેલી જોવા મળી છે. આ સંખ્યા હવે આ મહિને વધ વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. દરમિયાન, મહારાષ્ટ્રના ખેડૂતોના જણાવ્યા મુજબ આ વર્ષે રાજયમાં શેરડીનું ઉત્પાદન અપેક્ષાથી ઓછું થવાનો અંદાજ છે. મહારાષ્ટ્રમાં પ્રતિકૂળ હવામાનના કારણે શેરડીનું ઉત્પાદન ઘટવાની ભીતિ ખેડત વર્ગ બતાવી રહ્યો છે. દરમિયાને ઉત્તર પ્રદેશમાં આ નવી મોસમના પ્રથમ મહિનામાં આશેર૧ ૦૪ જેટલી ખાંડ મિલોએ શેરડીનું પિલાણ શરૂ થયું છે તથા આ ગાળામાં ત્યાં ખાંડનું ઉત્પાદન આશરે ૧૧ લાખ ૨૦થી ૨૫ હજાર ટન જેટલું થયાના વાવડ

. મોકટોબર ૨૦૨૨થી શરૂ થઈ છે જે સપ્ટેમ્બર ૨૦૨૩ સધી ચાલવાની છે કુમકનું કોઈ મૂલ્ય નથી. ભારત રશિયાનું પ્રાચીન મિત્ર છે અને એ

પણ ચોથી લહેર આવશે ખરી?

ચેપ લગાડી શક્યો નથી એ આપણં છે તે ભારતની ન થાય તે માટે આજે ભારતમાં ઇતિહાસની સહુથી મોટી મોકડીલ યોજવામાં આવી. અખા દેશની તમામ હોસ્પિટલોમાં કોરોના સામે લડવા માટે શું તૈયારીઓ છે તેની તપાસ કરવામાં આવી. પ્રથમ અને બીજી લહેરમાં આપણી હોસ્પિટલો કોરોનાથી પીડિત દર્દીઓના આપણે સદેહે જીવી રહ્યા છીએ. જુવાળને પહોચી વળવા માટે તૈયાર આપણી પેઢી માટે કોરોનાની ઘટના જીવનની સૌથી મહત્ત્વપર્ણ ન હોતી હોસ્પિટલોમાં ડોક્ટરો નર્સો, ઓક્સીજન, બેડ, વેન્ટીલેટર ઘટનાઓમાંની એક છે. પૃથ્વી પર વગેરેની અછત હતી અને એની સામે ઘટનાઓ બહુ ઝડપથી ઘટી રહી છે. માનવજાતે જેટલી ઝડપ પકડી છે દર્દીઓની સંખ્યા ધર્યા કરતા ખુબ જ વધુ હતી. તે સમયે જે અવ્યવસ્થા થઇ .. એટલી જ ઝડપથી હવે સૃષ્ટિમાં હતી અને દર્દીઓએ જે હાલાકી બનાવો બની રહ્યા છે. અગાઉ દૂર્ઘટનાઓ,કુદરતી આપત્તિઓ ભોગાવવી પડી હતી તે ફરીથી ન ભોગવવી પડે એ માટે આ મોકડીલ સદીઓમાં એકાદ આવતી. સનામી યોજવામાં આવી. તૈયારીઓ તપાસી એકાદ આવતું. મહામારી એક લેવામાં આવી એ યોગ્ય છે પણ લાગે મદીમાં એકાદ આવતી ઘટનાઓની

દેશોમાં કોરોના ભયંકર સ્વરૂપ ધારણ

કરી રહ્યો છે. પણ ભારત હજી

સલામત છે. નવો વેરિયન્ટ બિએફ

સેવન પણ ભારતમાં આવીને બહુ

છે એવું કે ભરાત ત્રીજી લહેરની જેમ

થરથર કંપી રહી છે. કારણ કે બધા

હવેના સમયમાં ઘટનાઓ બહ જ ઓછા સમયમાં ઘટે છે. આપણી જ પેઢીએ સુનામી જોયાં. આપણી પેઢીએ વિશ્ર્યયુદ્ધ જોયાં. આપણી પેઢીએ મહાસંહાર જોયો. આપણી પેઢીએ મહાવિનાશ ભૂકંપ જોયા. આપણી પેઢીએ સૌથી તારાજી ફેલાવનાર પૂર જોયાં,અતિવૃષ્ટિ જોઈ,અનાવૃષ્ટિ જોઈ. આપણી પેઢીએ માણસને ચંદ્ર પર જતો જોયો અને આપણી જ પેઢીએ કોરોના પણ જોયો. અત્યાર સુધીની કોઈ પેઢીએ આટલું બધું એકસાથે જોયું નથી. ઘણી પેઢીઓ તો કોઈ મોટી ઘટના જોયા વગર જ જીવન જીવીને પત્વી પરથી વિદાય થઈ ગઈ. આપણી પેઢી નસીબદાર કે કમનગીબ છે કે અન્ય પેઢીઓએ જે હજારો વર્ષમાં જોયું તે આપણે છેલ્લા પચાસ-પોણોસો વર્ષમાં જોઈ લીધું. કોરોના સામેની લડાઈમાં તમે છો.કઈ રીતે આપવાના છો એ તમારે નક્કી કરવાનું છે. માણસજાત જી तथा नी अ हुई तभा रूं यो गहा न ओ

આ જગતના ઈતિહાસમાં પ્રથમ વખત લડાઈ રહ્યું છે. ઘરમાં બેઠેલા પણ લડે અને ફ્રન્ટલાઈન પર ઊભેલા પણ લડે. આ એવં પ્રથમ યદ્ધ છે જેમાં બચાવ સૌથી મોટો પ્રતિકાર છે બચાવ જ હમલો છે. આ એવં યદ્ધ છે જેમાં એકઠા થવાને બદલે દૂર રહેવાનું છે. બહુ જ અદ્ભૃત લડાઈ છે અને આપણે એક ઈતિહાસ જીવી રહ્યાં પૃથ્વીના ઈતિહાસમાંથી કથારેય નહીં ભૂંસાનાર ઘટનાને

તૈયારીઓ આ વખતે પૂરી છે

## યુક્રેન વિનાશને

વચ્ચે સદીઓ,દાયકાઓનું અંતર

રૂમ હીટર બંધ છે. રશિયાએ વિદ્યુત માળખાઓ પર ખતરનાક મિસાઈલો દાગી છે. નવા ડ્રોન હુમલાઓમાં અનેક વધુ નાગરિકોની જાનહાનિ થઈ છે. યુક્રેન અને રશિયા વચ્ચેનો . ગજગ્રાહ હવે અનિયત ઓક્ટોપસ જેવો થઈ ગયો છે. એના અનેક છેડા છે અને એના ઘટનાક્રમની ગતિ પણ સીધી રેખા જેવી નથી. મુળભૃત રીતે આ સંઘર્ષઅમેરિકાના જગત જમાદાર તરીકેના પદ પરના રિપ્લેસમેન્ટનો છે. અગાઉ અનેક પ્રસંગોએ ચીન પોતાની સર્વોપરિતા પુરવાર કરવા માટે કીડી ચડેલા સાપની જેમ માથાં પછાડી ચૂક્યું છે છતાં અમેરિકાની સર્વોચ્ચતાને હણી શક્યું નથી. હવે રશિયાએ પોતાની તાકાતનું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન શરૂ કર્યું છે, પરંતુ પુતિન ખુદ પણ અમેરિકાથી ડરી ડરીને આગળ વધી રહ્યા છે. ઉત્તર કોરિયાને મહોરું બનાવીને ચીને અનેકવાર અમેરિકાને પડકાર્યું છે, પણ એનું કોઈ પરિજ્ઞામ આવ્યું નથી. છતાં આ વખતની રશિયાની ચાલબાજી એક માસ્ટર ગેઈમ છે. રશિયાના ટુકડા થયા ત્યારે બધાએ માની લીધું કે રશિયન વિચારધારાના પણ ખંડ-વિખંડ થઈ ગયા છે. દુનિયાને પછીથી બહુ ઝડપથી જોકે ખ્યાલ આવી ગયો હતો કે સામ્યવાદના મૂળમાં છુપાયેલો મડીવાદી સામ્રાજ્યવાદ હજય રશિયાના આત્મા તરીકે છે. છેલ્લ કેટલાક દિવસથી અમેરિકા પણ્મુખી વાર્તાલાપ કરે છે. એણે રશિયાને ધમકી આપી પણ માત્ર પોતાન નાગરિકોની સુરક્ષા માટે. નાટો દેશોના સંગઠક પ્રવક્તા પણ સતત ફરતં ફરતં બોલે છે. યક્રેનના . વડાપ્રધાન આંખે પાટા બાંધીને સરહદ પર ભટકતા હોય એવં ચિત્ર છે. કારણ કે તેઓ સ્પષ્ટ રીતે જાણતા નથી કે તેમની મદદમાં હવેની અંતઘડીએ કોણ કેવી રીતે આવશે. અમેરિકા --મહિતના વિવિધ દેશોએ યુક્રેનને મોકલેલી લશ્કરી કુમક નહીં જેવી અને હાસ્યાસ્પદ નીવડી છે. ચારેબાજુથી સહસ્ર ફેણે શત્ર તરીકે ફંફાડા મારતા રશિયા સામે યુક્રેન પહોંચેલી વિદેશી

એટલે ભારતે અલિપ્તતા જાળવી છે. જે રીતે ચીનની ચાલાકીઓ છાની રહી શકી નથી અને પ્રગટ થઈ . જાય છે એ રીતે રશિયા પણ હવે કોઈ

મિત્રતા હમણાં જ અપડેટ થયેલી છે.

અભેદ્ય કવચમાં છુપાઈ રહી શકે એમ નથી. મીડિયા અને સોશિયલ મીડિયાની પહોંચ બહુ વધી ગઈ છે. કોઈ પણ કૌભાંડ કદાચ તરત તળિયેથી નળિયે ન પહોંચે એવું બને, પણ સમયની રકતારમાં એ એક ને

એક દિવસે તો જગતના ચોકમાં જાહેર થયા વિના રહેતં નથી. ઝિગ ઝિગલર કહે છે કે કૌભાંડ આચરનારાઓએ પહેલેથી જ એ જાહેર થાય ત્યારના સંયોગોનો એક રોડમેપ એડવાન્સમાં ઘરી ગામવો જોઈએ

### çokul

#### ગોકુલ એગ્રો રીસોંસીસ લિમીટેડ

- દસ્ત્રી (1.04) લાઇક સામાન્ય લગા (AGM) સુરુલા; ટ્રન્સી આંગસ; ૨૦૨૪ ના રાષ્ટ્ર સાથા ૧ ૧૧૩ લાઇ ૧ ૧૫૩ લાઇ ૧ ૧ ૧૫૩ લાઇ ૧ ૧ ૧ ૧ ૧૫૩ લાઇ ૧ ૧ ૧૫૩ લાઇ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧

રાલા/-, અંહિતા પરમાર, હંપની સેકેટરી